DISHA RESOURCES LIMITED

(FormerlyKnown as Arihant Avenues and Credit Limited)

REGD. OFFICE: 3, RAJESH APARTMENT, B/H. NAVGUJARAT COLLEGE, ASHRAM ROAD, INCOME TAX, AHMEDABAD-380014

PHONE: (OFF). 2754-0790, 27543060 E-MAIL: info@aacl.co.in CIN: L74110GJ1995PLC024869

DRL/SE/2019/P61 January 31, 2020

To,
The Manager, Listing
BSE Limited
PhirozeJeejeebhoy Towers,
Dalal Street,
Mumbai- 400 001

Dear Sir/Madam,

Attn: Market Operation Department

Dear Sir,

Sub.: Publication of Advertisement for the Board Meeting Notice under regulation 47 of (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015
Ref: Company Code: BSE: 531553.

With regard to above please find enclosed herewith copies of Free Press-English and LokMitra - Gujarati edition dated January 31, 2020 in which Notice for the Board Meeting of the Company to be held on 14th February, 2020 were published.

You are requested to please take note of same.

Thanking You,

Faithfully Yours,

FOR DISHA RESOURCES LIMITED

(Formerly Known as Arihant Avenues and Credit Limited)

KRISHNA AWTAR KABRA MANAGING DIRECTOR

DIN: 00650817

Encl: As Stated



Hyundai Motor India Rolls-out Fastest 3 Millionth Made-in-India Export Car



Ahmedabad: Hyundai Export Roll Out is a significant Motor India Ltd, India's First Smart Mobility Solutions Provider and largest exporter since inception, today achieved yet another significant milestone with roll out of 3 Millionth Made-in-India Export car - A 'Hyundai AURA' (Export name - GRAND i10) for Colombian market from its state-of-the-art plant in Sriperumbudur near

Made-in-India 3 Millionth markets." (1-7)

milestone as it showcases the global success story for brand Hyundai. We started our export operations in 1999 and created many milestones. We thank our all our global customers and overseas distributors for their trust and support which has helped us reach this landmark. Drawing strength from Hyundai's vision of 'Progress for Humanity' we will continue to Commenting on the offer all-around premium milestone achievement, Mr S experience to our customers S Kim, Managing Director & through our quality products, CEO, HMIL said, "The fastest both in the Indian and global

Ather Energy introduces Ather 450X, the super scooter

Energy today unveiled an Mumbai, Pune, Hyderabad advanced performance and along with Bengaluru and intelligent electric scooter, Ather 450X. The super scooter comes packed with brand new features, advanced 4G connectivity and a brand new ownership on its success, Ather will be model, at INR 99,000 offering a referral program for (Bengaluru) up front and a customers so that they can monthly subscription.

Ahmedabad: Ather beginning with Delhi NCR,

Ather's exclusive invite campaign saw thousands of pre-orders coming in from more than 300 cities. Based share the benefits of pre-Ather recently signed an ordering the Ather 450X with MoU with the Tamil Nadu their friends and family. With government to build a new the demand pouring in for the 400,000 sq ft facility and is super scooter, Ather will be now moving to the next rapidly expanding its phase of its growth. Ather is operations to all key markets scaling up its operations through retail partnerships across the country with Ather which will offer test rides and 450X being available across after sales service across 10 major cities in India India. (19-10)

Wonder Cement launch its grinding unit in Madhya Pradesh



Ahmedabad: Wonder with the way we source raw Cement, one of the country's material, with our tech-based leading cement manufacturing manufacturing process and companiestoday announced the launch of their newest product. Fundamentally, we facility, a world class grinding get very good quality raw unit in Badnawar Madhya material from our mines. But Pradesh. This is Wonder what's unique about us is not Cement's second grinding unit just limestone, but the in the country; the first grinding stringent quality control unit is in Dhule, Maharashtra systems. Our ardent which was launched in the month of August 2018.

focus on quality: "There are an unparalleled delivery of things which we do to world class product to our maintain top-notch quality, end customers. (19-10)

efficient transportation of the technology and heavy investments made on Mr. Vivek Patni, Director, machineries including Wonder Cement, explains the scanners and filters gives us

'100 Farmers. 100 Stories' Photo & Video Story Contest launched by TAFE - Be a #FarmDost

Ahmedabad: TAFE Tractors and Farm Equipment Limited, the world's third largest tractor manufacturer, launches'100 Farmers. 100 Stories' - a nationwide Photo and Video Story Contest, dedicated to the farming communityas part of its 'Be a #FarmDost' initiative. The objective of this unique contest is to curate the top 100 inspiring stories of farmers across India and spotlight the invisible farming community and agriculture as a profession. The contest has two main categories - Photo Stories and Video Stories, and offers Prizes categories to the winners, besides also awarding and



featured in the winning entries. The Contest is open to all Indians above 13 years of age without any entry fee, and is being run on digital media platforms, urging participants to meet with farmers and share their inspiring and compelling stories with the help of photosor videos supported by the story worth uptoRs. 2,20,000* across behind them, which highlight positivity in farming and celebrate the contribution of recognizing the farmers farmers to the society. (19-10)

UFBU call for 2 days strike

unions which consists of 9 February bank unions including All India Bank Employees Association (AIBEA), All India Bank Officers' Confederation (AIBOC), National Confederation of Bank Employees (NCBE), All India Bank Officers' Association (AIBOA), Bank Employees Federation of rise as well as to India (BEFI) among others meet the demands have given all India Bank of the various strike call on 31st January, 1st Feb, 11th, 12th & 13 March and thereafter have elapsed. The indefinite strike from 1st April 2020 demanding early and respectable wage revision, 5 day week, defined working hour for officers, scrap new pension scheme and revision/ updation of family pension/ pension. They oppose

sector as it is a prelude for privatization. They have also announced plans for protest methods from 2020. The timing of the October 31, 2017, the bank strike particularly on employees got a 15 per cent

United forum of Bank 31st January and 1st hike. assumes significance as it coincides with Budget Day.

According to AIBOC (All Bank Offices Confederation), the increase in wages is for seeking

compensation

against the price

situations in the society. 32 months progress was in snails's pace. Our patience has reached the tolerance level. UFBU says that the unanimous decision to intensify agitation was taken after talks with Indian Banks' Association (IBA) failed. UFBU in circular has alleged stiff approach of the Indian amalgamations in banking Banks' Association on demands for a fair wage revision settlement. UFBU is seeking at least a 15-per cent demonstrations, signature hike, but the IBA has capped campaigns and poster the raise at 12.25 per cent. displays among other In the past wage settlement, which was for the period January 20, 2020 to April 1, November 1, 2012, to

No headway has been made in the process so far even after 32 months since the discussion on wage revision began. Around 3.2 lakh officers participated in the strike. The

the 11th bipartite settlement relating to salary and perks, giving effect to wage revision at earliest, striking a balance in the duties and work of officers, giving effect to fiveday-week in banks, upward revision of pension of retired

demands of bank

officers include

implementation of

bank officials, giving preference to basic banking transactions, banning marketing of non-banking products, cancellation of New Pension Scheme and give effect to specific pension etc. The banking industry in

India witnessed sea-change through nationalization of banks in the years 1969 and 1980 with the sole aim of promoting small savings for self-sufficiency and for utilizing the banks as catalytic agents for economic growth.

AIBOC opposes the move to merge nationalized banks as the merger would result in reducing staff size and number of branches of associate banks in the name of rationalisation of operations.

During last more than seven decades Bank Employees had fought many Battles - but have not lost in a single one. They have won in each and every battle. Their strength is their unity among rank and file supporting this strike call. No doubt, banking services like cash withdrawal and deposits are going to affect at several bank branches where employees will not turn up for work and instead chose to sit outside on protest but on the other side bank employees have always played a vital role in strengthening banks and economy and they must be rewarded in the form of their justified demands.

Vinod Chandrashekhar Dixit

dixitpatrakar@yahoo.in Jyoti-Kalash B-15 Society, Jodhpur Tekra Satellite,

May 2019 itself. The work was

planned judiciously &

milestones viz. casting of

foundation, mast erection,

brackt assembly, wiring &

adjustments etc. were critically monitored. With

great dedication and

keenness towards completion

of the project, the work of electrification of Mahesana -

Vadnagar section of 34.43

route km. has been

completed within the record

though the Mahesana-

Vadnagar section faced

torrential rains during the

monsoon season which held

up the work for about 3

months, Western Railway

Bhakar added that even

time of mere 8 months.

approximately 1.7mn stroke cases annually. Despite the vast number, stroke cases in India still go un-reported. There are two kinds of being2:1." (19-10)

Elaborating further Dr Kalpesh Shah, Interventional Neurosurgeon, Zydus Hospital, Ahmedabad said,"I see about 8-10 cases of hemorrhagic stroke every month. In my clinical observation women are more prone to aneurysm ruptured hemorrhagic stroke

Hemorrhagic stroke is lethal than an ischemic stroke if not treated on time: Expert



Ahmedabad:

Approximately, 15 million people worldwide have suffered from stroke in their lifetime. In India, Stroke is the 2ndleading cause of death and the leading cause for disability. As per India: Health of the Nations States - The India State-level Disease Burden initiative by ICMR, PHFI and IHME, 2017 report, India witnesses

stroke, Ischemic stroke and Hemorrhagic Hemorrhagic stroke accounts for 13% of the stroke cases. It is more lethal and mortality rates range from 33% to

compared to men with a ratio

Wetlands - Miracles in Mumbai An EPIC Original To Celebrate World Wetlands Day

Ahmedabad: On February 2, 1971 a small group of environmentalists signed an international agreement at the Ramsar Convention in Iran - this day came to be known as World Wetlands Day. On this occasion, EPIC Channel - India Ka Apna Infotainmentbrings a new Original - Wetlands - Miracles in Mumbaicontinuing the channel's endeavor to focus on the country's ecological diversity. EPIC Channel with a legacy of some exceptional innovative content has been a pioneer in curating and creating premium Indiacentric originals in the past couple of years, redefining the infotainment genre.

WESTERN RAILWAY - RAJKOT DIVISION

entirely



4K, Wetlands - Miracles in Mumbaiwill take the audience across these hidden biological gems in India's business capital, along with underlining its strong position in coping with the alarming climate crisis. The original - a 40minute filmwill be telecast at 1:00 pm, 4:00 pm & 8:30 pm to celebrate the World Wetlands Day, February 2, in 2020, on EPIC Channel. ★

WESTERN RAILWAY COMPLETES ELECTRIFICATION OF THE NEWLY CONVERTED BROAD GAUGE LINE

Ahmedabad: Western Railway is contributing immensely infrastructural development of railways in Gujarat and in last 5 years tremendous boost has been given to conversion, gauge electrification, doubling and elimination of the unmanned level crossings along with enhancement of passenger amenities. Western Railway has once again accomplished a great feat of completing the electrification of the newly converted broad gauge line between Mahesana and Vadnagar in just 8 months. On 29th January, 2020, Shri R.K. Sharma - Commissioner of Railway Safety conducted an inspection of the work at Vadnagar station alongwith entire project.

According release issued by Shri The Gauge Conversion work Ravinder Bhakar - Chief of Mahesana - Vadnagar

www.bseindia.com .

Date: 30.01.2020 Place: Ahmedabad



Public Relations Officer of Western Railway, the section between Mahesana and Vadnagar is part of the The electrification of this Mahesana - Taranga Hill Gauge Conversion project.

section of 34.43 km was completed and opened for traffic on 23rd July, 2019. section was sanctioned by 2019 at a total cost of Rs. 74.66 cr. The electrification Railway on war footing and mission of

projects being executed Western Railway to realize work was taken by Western the nation's ambitiou the work began in month of electrification of railways.

A zota

70TA HEALTH CARE LIMITER	
ZOTA HEALTH CARE LIMITED	
CIN: L24231GJ2000PLC038352	
Registered office: Zota House, 2/896, Hira Modi Street,	
Commence Court 2017000, Fill Moul Street,	
Sagrampura, Surat-395002, Gujarat	
Ph · +91-261-2331601 Tele Fax· 0261-2346415	
i	
F.	
~	
· · · · · · · · · · · · · · · · · · ·	
· ·	
· · ·	
West or a con-	
i.	
·	
i i i i i i i i i i i i i i i i i i i	
į	
7 to 2 to 3	
£.'-	
:	
· ·	
P.	
<u>·</u>	
F	

was able to complete the work in record time. Western Railway has certainly set a benchmark for other similar projects being executed by Western Railway to realize the nation's ambitious mission of 100% electrification of railways.	
ota	
CARE LIMITED	
000PLC038352 se, 2/896, Hira Modi Street, -395002, Gujarat rele Fax: 0261-2346415	
6	-
	J
	1 Bright year of the second
4	7
	•
1 2	
į	
	Y
-	
,	
!	
4	
	734
The second secon	
	<u> </u>

DISHA RESOURCES LIMITED

(Formerly Known as Arihant Avenues and Credit Limited)

REGD. OFFICE: 3, RAJESH APARTMENT, B/H, AJANTA COMM.

ESTATE, ASHRAM ROAD, AHMEDABAD-380014 PHONE: (OFF). 2754-0790, 27543060

E-MAIL: info@aacl.co.in CIN: L74110GJ1995PLC024869

NOTICE

Notice is hereby given pursuant to Regulation 29 read with Regulation 47 to

SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a meeting of the Board of Directors of the Company is scheduled to be

held on Friday, 14th February, 2020 at the registered office of the company

inter-alia to consider and approve the Unaudited Standalone Financial Results for the Third quarter and nine months ended as on 31st December, 2019.

In this regard, trading window had already been closed from Wednesday

January 01, 2020 for all designated persons. The same shall remain closed till 48 hours after declaration of Unaudited Standalone Financial Results of the

Company for the Third quarter and Nine months ended as on 31st December

The information contained in this notice is also available on the company's

website at www.aacl.co.in and on the website of stock exchange i.e

FOR DISHA RESOURCES LIMITED

KRISHNA AWTAR KABRA

MANAGING DIRECTOR DIN: 00650817

(Formerly Known as Arihant Avenues and Credit Limited)

Website: www.aacl.co.in

MAS FINANCIAL SERVICES LIMITED

CIN: L65910GJ1995PLC026064 Regd. Office: 6, Narayan Chambers, Gr Floor, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380009, Gujarat Tel: 079-41106500, Fax: 079-41106597/561, Website: www.mas.co.in E-mail: riddhi_bhayani@mas.co.in

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015("LODR"), Meeting of the Board of Directors of the Company will be held on Wednesday, February 5, 2020 inter- alia, to consider and approve Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and nine months ended on December 31, 2019; Re-appointment of Mrs. Daksha Niranjan Shah (DIN: 00376899) as Woman Independent Director of the Company for second term of 5 years; To consider and approve draft notice of Postal Ballot and such other business.

Further, in accordance with Regulation 46 of LODR, the details of the aforesaid meeting are available on the website of the Company i.e. www.mas.co.in and also on the website of the stock exchanges i.e. www.nseindia.com and www.bseindia.com

For, MAS Financial Services Limited Date: 29.01.2020

Place: Ahmedahad Riddhi Bhaveshbhai Bhayani Company Secretary and Compliance Officer Membership No. A41206

લિટલ સિર્ઝસિં પિત્ઝાએ ઓલ-ન્યુ, ઓલ-વેજ મેનુ સાથે ભારતમાં વિસ્તરણ કર્યું



સૌથી મોટી પિત્ઝા ચેઇન લિટલ સિઝર્સ પિત્ઝાએ આજે ૨૯ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ અમદાવાદમાં પોતાની પ્રથમ બે રેસ્ટોરાંના ઉદ્ઘાટનની ઉજવણી કરી હતી. આંતરરાષ્ટ્રીય પિત્ઝા બ્રાન્ડ હવે વિશ્વભરના ૨૬ દેશો અને બે પ્રદેશોમાં કામગીરી ધરાવે છે તથા સમગ્ર એશિયામાં નવા રેસ્ટોરાં પિત્ઝાની ઉચ્ચ ગુણવત્તા તથા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કામગીરી વિસ્તારવાનં જાળવી રાખ્યં છે. પ્રથમ બે લિટલ સિઝર્સ રેસ્ટોરાંની માલીકી અને સંચાલન ફ્રેન્ચાઇઝી ફોનિક્સ એન્ટરપ્રાઇઝ નેક્સસ ઇન્ટરનેશનલ પૌલા વિઝિંગે જણાવ્યું ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું છે તેમજ હતું. "લિટલ સિઝર્સ માટે ભારત તેનું વ્યવસ્થાપન નંદિશ પટેલ દ્વારા અત્યંત મહત્વપૂર્શ માર્કેટ છે અને અમે કરાશે, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પણ ઘણાં લિટલ સિઝર્સ પિત્ઝા રેસ્ટોરાં ધરાવે છે. પ્રથમ બે છીએ." (૨૦-૪)

અમદાવાદઃ વિશ્વમાં ત્રીજા ક્રમની રેસ્ટોરાં શોપ નં. ૧૨, શિવાલિક શિલ્પ. ઇસ્કોન ચાર રસ્તા. એસ.જી. હાઇવે તેમજ શોપ નં. ૩, વિશ્વનાથ નોર્થ વ્યૂ, એલ.ડી. કોલેજની સામે,

યુનિવર્સિટી રોડ ઉપર આવેલી છે. "અમે વૈશ્વિક સ્તરે અમારી ઉપસ્થિતિ વિસ્તારવાનું જાળવી રાખ્યું છે ત્યારે ભારતમાં લિટલ સિઝર્સ સ્વાદિષ્ટ પિત્ઝાને વાજબી કિંમતે રજૂ કરતાં ઉત્સાહિત છીએ ." તેમ લિટલ સિઝર્સ એન્ટરપ્રાઇઝિસ ઇન્ક. માટે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ આગામી કેટલાંક વર્ષોમાં દેશભરમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા રાખી રહ્યાં

મહિન્દ્રા ફાઇનાન્સઃ એયુએમ ૧૬ ટકા વધીને રૂ. ૭૫,૦૦૦ કરોડને વટાવી ગઈ

અર્ધશહેરી બજારોમાં નાણાકીય વધીને રૂ. ર, દ૧૬ કરોડ થઈ હતી, જે સેવાઓ પ્રદાન કરતી ટોચની કંપની ગયા વર્ષનાં સમાન ગાળામાં રૂ. મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (મહિન્દ્રા ફાઇનાન્સ)નાં બોર્ડ ૨૦૧૯નાં રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ઓફ ડાયરેક્ટર્સે ૩૧ ડિસેમ્બર, ગાળા દરમિયાન કરવેરાની ચુકવણી ૨૦૧૯નાં રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક અગાઉનો નફ્રો (પીબીટી) રૂ. ૪૮૮ ગાળા અને નવ મહિનાનાં ગાળા માટે બિનહિસાબી નાશાકીય પરિશામોની ગાળાના રૂ. ૫૨૦ કરોડ કરતાં ૬ ટકા આજે જાહેરાત કરી હતી.

૨૦૧૯ – ડિસેમ્બર, ૨૦૧૯) સ્વતંત્ર ૨૦૧૯નાં રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક કરોડ કરતાં ૧૪ ટકા વધારે હતો. (૧)

અમદાવાદઃ ગ્રામીણ અને ગાળા દરમિયાન કુલ આવક ૧૬ ટકા ૨,૨૪૬ કરોડ હતી. ૩૧ ડિસેમ્બર, કરોડ હતો, જે ગયા વર્ષનાં સમાન ઓછો હતો. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯નાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નો રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા ત્રીજો ત્રિમાસિક ગાળો (ઓક્ટોબર, દરમિયાન કરવેરાની ચુકવણી પછીનો નફો (પીએટી) રૂ. ૩૬૫ કરોડ હતો, જે ધોરણે પરિણામો ૩૧ ડિસેમ્બર, ગયા વર્ષનાં સમાન ગાળાના રૂ. ૩૧૯

અર્બનક્લેપ હવે અર્બન કંપની તરીકે ઓળખાશે



અમદાવાદઃ ભારતની અગ્રણી ગિગ માર્કેટપ્લેસ અર્બનક્લેપે તેના નામમાં (કોર્પોરેટ બ્રાન્ડ આઇડેંટટિટિ) પરિવર્તન કરતા નવીન નામ અર્બન અમદાવાદમાં તેની કામગીરી શરૂ કરી કંપની લોન્ચ કરવાની ઘોષણા કરી. આ નામ પરિવર્તન બ્યુટી, સ્પા, રીપેર શહેરમાં અર્બન કંપની દ્વારા પોતાની એન્ડ મેંટેનેન્સ (સમારકામ), સફાઇ, પેઇન્ટિંગ વગેરે જેવી સર્વિસિસ કેટેગરીમાં ગ્લોબલ ફ્ટપ્રિંટ અને લીડરશિપ પોજીશન સાથે વ્યાપક આવી હતી. પાછલા પ વર્ષોમાં, તે ૪ માર્કેટ પ્લેટફોર્મ બનવાની કંપનીની દેશોમાં (ભારત, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર મહત્વાકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. આ અને યુએઈ) તેનો સધી વિસ્તાર કર્યો છે. નવું નામ કંપનીને વિશ્વવ્યાપી લાખો આજે ૨૦,૦૦૦+ પ્રશિક્ષિત પ્રોફેશનલ્સને ઘરે અગાઉ કયારે ન વ્યાવસાયિકો ૩ મિલિયનથી વધુ ઘરોમાં

પહોંચાડવા માટે સશક્ત બનાવવા માટે તેના વિજન પર ભાર મૂકે છે.

કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૬ માં હતી અને આજે ૬૦૦ ગિગ કામદારો આજીવિકા ચલાવે છે. અર્બનક્લેપની શરૂઆત નવેમ્બર ૨૦૧૪ માં દિલ્હીમાં મુક્રીભર સેવા વ્યાવસાયિકો સાથે કરવામાં અનુભવ કરવામાં તેવી સેવાઓ સેવા આપી રહયા છે. (૧૩-૫)

પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને એમ જી આર ચેજ્ઞાઇ સેન્ટ્રલ વચ્ચે વાયા વસઈ રોડ વિશેષ ટ્રેનની ૧૦ સેવાઓ

સુવિધા માટે તથા વધારે પડતી ભીડ મંગળવારે ૧૭:૧૦ કલાકે એમ જી ને ઓછી કરવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા આર ચેન્નાઇ સેન્ટ્રલ પહુંચશે. આ ટ્રેન અમદાવાદ અને એમ જી આર ચેજ્ઞાઇ 3 ફેબ્રુઆરી થી ૨ માર્ચ, ૨૦૨૦ સુધી સેન્ટ્રલ વચ્ચે વાયા વસઈ રોડ એક ચાલશે. વિશેષ ટેનની ૧૦ સેવાઓ વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લીધો છે. આ વેશેષ ટ્રેનની વિગતો નીચે

અમદાવાદ-એમ જી આર ચેજાાઇ આગલા દિવસે રવિવારે ૨૧:૧૫ સેન્ટ્રલ વિશેષ ટ્રેન (૧૦ ફેરા) ટ્રેન નં. કલાકે વસઈ રોડ પહું ચશે અને ૦૬૦૫૨ અમદાવાદ-એમ જી આર સોમવારે ૦૪:૧૦ કલાકે અમદાવાદ ચેત્રાઇ સેન્ટ્રલ વિશેષ ટ્રેન અમદાવાદ પહુંચશે. આ ટ્રેન ૧ ફેબ્રૂઆરી થી થી સોમવારે ૦૯:૪૦ કલાકે ઉપડીને ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી તે જ દિવસે ૧૬:૫૫ કલાકે વસઈ રોડ ચાલશે.

અમદાવાદઃ યાત્રીઓની સારી પહુંચશે અને આગલા દિવસે

આવી જ રીતે પરત યાત્રા માં ટ્રેન નં. ૦૬૦૫૧ એમ જી આર ચેશાઇ સેન્ટ્રલ-અમદાવાદ વિશેષ ટ્રેન એમ જી આર ચેજ્ઞાઇ સેન્ટ્રલ થી ટ્રેન નં. ૦૬૦૫૨/૦૬૦૫૧ શનિવારે ૨૦:૩૦ કલાકે ઉપડીને

મંજુલા પૂજા શ્રોફ્રે પાખંડી નિત્યાનંદને આંધ્ર પ્રદેશમાં પણ પેલેસ આપ્યો હતો

વડોદરા : હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાના કેસમાં ગ્રામ્ય પોલીસે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વા સામે અમદાવાદ જિલ્લા કોર્ટમાં ૮૩ પાનાંનું ચાર્જશીટ રજૂ કર્યું હતું, જેમાં નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરી બ્લૂકોર્નર નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે અને હવે તેની પાસે કલમ ૭૦ મુજબનું વોરંટ મેળવી રેડકોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરાશે.

ચાર્જશીટમાં ફરિયાદી જનાર્દન શર્માની ૧૫ વર્ષની દીકરી કલ્પલતા ઉર્ફે માયાપ્રિયાએ પંચોની હાજરીમાં પોલીસના ૫૫ સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં આંધ્રપ્રદેશમાં મંજુલા પૂજા શ્રોફે નિત્યાનંદને એક પેલેસ આપ્યો હોવાનો ઘટસ્ફોટ પણ કર્યો હતો અને તેમણે જ નિત્યાનંદનું પ્રમોશન કર્યું હતું. આશ્રમમાં સ્પિરિચ્યુઅલ પ્રોસેસના નામથી સજા આપી બે મહિના સુધી એક રૂમમાં પૂરી દીધી હોવાનં પણ કલ્પલતાએ પોલીસને કહ્યું હતું. ગ્રામ્ય ડીવાયએસપી કે.ટી.કામરિયાએ કહ્યું કે. એસઆઈટીએ પ૦ સાક્ષીઓનાં નિવેદન સાથે ૮૩ પાનાંનું ચાર્જશીટ રજૂ કર્યું હતું, જેમાં બાળકો જોડે મજૂરી કરાવી મેળવેલા રૂ.૯.૪૬ લાખની રકમના દાનને પણ પુરાવા તરીકે

જામળામાં ઘર ખાલી

કરવાના મામલે પત્ની

પર હુમલો કર્યો

જામળા ગામમાં ગત ગુરૂવારે એલગ

રહેતી પત્નિને ઘર ખાલી કરવાની

બાબતમાં ગાળો ભાંડી પતિએ લોખંડની

કોસ વડે પત્ની પર જીવલેણ હુમલો કરતા

પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

હુમલાની ઘટનામાં મહિલાના પુત્ર તેમજ

પુત્રવધૂએ પણ પિતાના ઉપરાણામાં આવી

તરફદારી કરતા ઇજાગ્રસ્ત પત્નિએ

જીવલેણ હુમલો કરનાર પતિ, પુત્ર અને

પુત્રવધૂ સહિત ત્રણ જણા વિરૂધ્ધ શનિવારે

હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં

મામલો દર્જ કરાવ્યો હતો. જામળા ગામમાં

ઓડવાસમાં રહેતા લીલાબેન વાઘેલાના

મનહરભાઇ વાઘેલા સાથે ૩૦ વર્ષ અગાઉ

લગ્ન થયા હતા. હિંમતનગરના ગ્રામ્ય

પોલીસ સ્ટેશનમાં પોતાની પર જીવલેણ

હુમલો કરનાર પતિ મનહરભાઇ

બનાભાઇ વાઘેલા, પુત્ર કુમારશાનુ

મનહરભાઇ વાઘેલા અને પુત્રવધ્

અનિતાબેન કુમારશાનુ વાઘેલા વિરૂધ્ધ

મામલો દર્જ કરાવતા પોલીસે ત્રણેય જણા

વિરૂધ્ધ ગુનો દર્જ કરી તપાસ આદરી હતી.

ગ્રામ્ય પોલીસે શનિવારે પત્નિના માથામાં

લોખંડની કોસ ફટકારી જીવલેશ હુમલો

કરનાર પતિ મનહરભાઇ બનાભાઇ

છાત્રોને મોબાઇલ

તરફથી પુસ્તકો

तरक वाणवानी नेभ

ફોનનું ચલણ વધી રહ્યું છે ત્યારે કપડવંજ

તાલુકોના એક નાનકડાં ગામમાં નવી

પહેલ કરાઇ છે. અંતરિયાળ વિસ્તારના

કેવડિયા ગામમાં પુસ્તકાલયનું નિર્માણ

કરાશે. આ પુસ્તકાલયના નિર્માણ માટે

ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

જોવા મળી રહ્યો છે. આ પુસ્તકાલયનો

હેતુ કેવડિયા તથા આસપાસના

વિદ્યાર્થીઓને વાંચનલક્ષી સાહિત્ય મળી

રહે અને યુવાનો ફોનનો વપરાશ ઓછો

કરી વાંચન તરફ વળે તેવો છે. કપડવંજ

તાલુકાના કેવડિયા ગામમાં ગાંધી યુથ

ક્લબ અને કેવડિયા ગ્રામ પંચાયતના

સહકારથી એક નવા પુસ્તકાલયનું

નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના માટે

ગામના જ ધર્મેન્દ્રકુમાર દ્વારા જમીનનું

નિમિતે કેવડિયા ખાતે ગ્રંથાલયનું

ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો. આ

સમારભનું આયોજન ગાંધી યુથ

ક્લબના પ્રમુખ નિમેષભાઈ વાઘેલા

દ્વારા કરાયું હતું. ગ્રંથાલયનું ભૂમિપૂજન

નિમેષભાઈના હસ્તે કરવામાં આવ્યું

હતું. ભૂમિપૂજન બાદ સમારંભમાં

પધારેલા તમમા મહેમાનોનું પુસ્તક ભેટ

આપીને કેવડિયા પ્રાથમિક શાળાની

વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરવામાં

આવ્યું હતું. તેમજ આ પુસ્તકાલય માટે

જમીન આપનાર ધર્મેન્દ્રકુમાર તેમજ

તેમના પિતા શાંતિલાલનું સર્વે મહેમાનો

દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં

આ પુસ્તકાલયના નવ નિર્માણ

દાન કરાયું છે.

આવ્યું હતું.

નડિયાદ, એક બાજુ લોકોમાં સ્માર્ટ

વાઘેલાની ધરપકડ કરી લીધી હતી.

હિંમતનગર, હિંમતનગર તાલુકાના



સામેલ કરવામાં આવ્યા છે. વિવેકાનંદનગર પોલીસમથકે ફરિયાદી જનાર્દન શર્માએ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમમાં રહેતા તેમનાં બે સગીર બાળકોનું અપહરણ કરી, ગોંધી રાખી, બાળમજૂરી કરાવાતી હોવા અંગેનો ગુનો નિત્યાનંદ, આશ્રમ સંચાલિકા પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વા સામે નોંધાયો હતો.પોલીસે પ્રાણપ્રિયા, પ્રિયાતત્ત્વાની ધરપકડ કરીહતી.

હિતેષ પૂરીએ જણાવ્યુ કે,નિત્યાનંદ આશ્રમના ૨૧ વિદ્યાર્થીઓ ડીપીએસ ઈસ્ટમાં ભણતા હતા. નિત્યાનંદ યોગિની સર્વાજ્ઞાપીઠમ (નિત્યાનંદ મહિલા બેસીને જતી રહી હતી.

ગીર-સોમનાથ, ગત વર્ષની જેમ

આ વર્ષે પણ ગુજરાતના ખેડૂતોને

મુશ્કેલી વેઠવી પડે તેવું દેખાઈ રહ્યું છે.

ગત વર્ષે પાણીની અછતના કારણે

રાજ્યના ઘણા ખેડૂતોએ પોતાના

ખેતરમાં વાવેતર કર્યું નહોતું.

ચોમાસામાં સારો વરસાદ પડવાના

કારણે ખેડૂતો ખૂબ ખુશ થયા હતા પરંતુ

ચોમાસા પછી પણ કમોસમી વરસાદ

પડતાં ખેડૂતોના ખેતરમાં રહેલો પાક

વિસ્તારોના વાતાવરણમાં પલટો

આવતા વરસાદી છાંટા જોવા મળ્યા

હતા. રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર, દીવ

અને ગીર-સોમનાથના કેટલાક

વિસ્તારમાં વહેલી સવારથી આકાશમાં

કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા.

વાદળથી ઘેરાયેલં આકાશ જોઈને

ખેડૂતો ચિંતિત થયા હતા. ઉના અને

દીવ પંથકમાં વાતાવરણમાં પલટો

હોવાની સાથે કેટલાક વિસ્તારોમાં

ખેતરમાં મોટા પ્રમાણમાં ઘઉં, જીરૂ

અને ચણાના પાકનું વાવેતર કર્યું છે

પરંતુ વરસાદના કારણે ખેડૂતો

ચિંતામાં ગરકાવ થયા છે કે,

વરસાદ પડવાથી તેમના મોઢામાં

આવેલો કોળિયો હવે છીનવાઈ ન

જાય. ઉલ્લેખનીય છે કે,

સાયકલો નિક સરકવુલે શન

સિસ્ટમના કારણે હવામાન વિભાગ

સૌરાષ્ટ્રના ખેડૂતોએ પોતાના

વરસાદી છાંટા પણ પડયા હતા.

આશ્રમમાં નાના મોટા બાળકો માટે એક્ટિવિટીના ભાગરૂપે શાળા તરફથી માનદશિક્ષકોથી શિક્ષણ આપવામાં આવે છે, જેનો ખર્ચ ડીપીએસ ઈસ્ટ કરે છે. ફરિયાદી જનાર્દન શર્માની દીકરી કલ્પલતા પણ ધો.૧૧ સાયન્સમાં અમારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. ડીપીએસ ઈસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આશુતોષ દવેએ જણાવ્યુ કે, હાથીજણ ખાતે કેલોરેક્સ ફાઉન્ડેશનના નામે કુલ ૧૨ વીઘા ડીપીએસ ઈસ્ટના પ્રિન્સિપાલ જમીન છે, જેમાં ડીપીએસ ઈસ્ટ બનાવી છે. સ્કૂલની બાજુમાં આશરે ત્રણ વીઘા જેટલી જમીન સ્કૂલ તરફથી

સોરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાની

આશ્રમ)ને પાંચ વર્ષ માટે લીઝથી આપી હતી.

પુષ્પક સિટી બંગલોના મેનેજર બકુલ ઠક્કરના જણાવ્યાનુસાર નિત્યાનંદ આશ્રમમાં સાધુઓ માટે મકાનની જરૂરી હોવાનું વડોદરાથી આવેલા પરેશ પટેલે કહ્યું હતું, જેથી પુષ્પક સિટી બંગલોના ત્રણ મકાન ભાડે આપ્યા હતા. પછી તેમાં સાધ્વીઓ નાના બાળકો સાથે અવરજવર કરતી હતી.

ડ્રાઈવર પ્રહલાદ ઠાકોરે જણાવ્યાનુસાર ૩ નવેમ્બરે ભક્તિપ્રિયાએ મને એરપોર્ટ જવા બોલાવ્યો હતો. વોટ્સએપ પરથી મને લોકેશન મળ્યું, ત્યાં બોર્ડ પર પુષ્પક લખેલું હતું.

ત્યાં એક મહિલા મારી ગાડીમાં બેઠી હતી. એરપોર્ટ જવા નીકળ્યા ત્યારે ફોન પર કોઈની સાથે વાત કર્યા બાદ કાર આશ્રમ તરફ લઈ જવા કહ્યું હતું. થોડી વારમાં આશ્રમમાંથી દપટ્ટા બાંધેલી ત્રણ મહિલાઓ આવી કારમાં બેઠી હતી. પછી એરપોર્ટ જવા નીકળ્યા ત્યારે જશોદાનગર ચાર રસ્તા ખાતે કોઈનો તેમની પર ફોન આવતા ગાડી રોકાવી દીધી હતી અને મને ૬૦૦ રૂપિયા આપી જતા રહેવા કહ્યું હતું. થોડીવારમાં એન.કે. પાસિંગની કારમાં ત્રણેય

શખેશ્વરપૂરમ્ તીર્થની અંજનશલાકા વિધિ ધમધૂમથી સંપન્ન્



નંદીવર્ધનસાગરસુરિજી, બંધુ બેલડી આ. જિનચંદ્રસાગરસરિજી, આ. હેમચંદ્રસાગરસૂરિજી, હર્ષસાગરસૂરિજી, સાગરચંદ્રસાગરસુરિજી, આ. જિનચંદ્રસાગરસૂરિજી, કલાસુંદરસુરિ, હર્ષવલ્લભસુરિજી, કરી ૨૬ જાન્યુઆરીના સવારે અલગ 🛮 આભાર માન્યો હતો. (૧-૭)

અમદાવાદઃ મુંબઈના ચર્ચગેટ અલગ વિષયના વામા માતાના ક્રોસ મેદાનમાં ૨૧થી ૨૬ ૨૩૦૦ થાળ લઈને શ્રાવિકાઓ જાન્યુઆરીનો પરમાત્મા શંખેશ્વર ઉમટ્યાં હતાં. જેમાં મીઠાઈમાંથી ભગવાનનો શંખેશ્વરપૂરમ તીર્થ, પ્રભુના પાંચ અંજનશલાકાનો ભવ્ય કાર્યક્રમ કલ્યાણકો, અલગ અલગ તીર્થો વગેરે ગચ્છાધિપતી આ દોલતસાગરસુરિ બનાવ્યાં હતાં. શરૂઆત સવારે મહારાજા. તેમજ પ્રેરણાદાતા પ.ગુરુભગવંતોના મંગલાચરણથી અનુયોગચાર્ય લબ્ધિચંદ્રસાગરજી થઇ હતી જેમાં તીર્થના પ્રેરક મહારાજા આદિ ૪૦૦થી વધુ સાધુ– લબ્ધિચંદ્રસાગરજી મ.સા.ની વિશેષ સાધ્વી ભગવંતોની નિશ્રામાં પરિપૂર્ણ એન્ટ્રી થઈ હતી. લબ્ધિચંદ્રસાગરજીએ જણાવ્યું હતું કે હું વિશ્વમાં સાયન્સ કાર્યક્રમમાં આ. દ્વારા જૈન ધર્મને પહોંચાડવા માગું છું. ગુરુદેવ અભયસાગરજી મહારાજનું જે સ્વપ્ન હતું તેને આગળ વધારી રહ્યો છું. મારા વિચારોને મૂર્તિમંત કરવામાં મારો કોઈ પણ સુપર પાવર હોય તો તે સરેશ ડી. શાહ—સરત છે. શંખેશ્વર કરુણા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓને પણ ગુરુદેવે બિરદાવ્યા હતાં. ગુરુદેવશ્રીએ સોમસુંદરસુરિજી, નયપદ્મસાંગરજી પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, દાતાઓ, આદી ગુરુભગવંતોએ નિશ્રા પ્રદાન કાર્યકર્તાઓ અને ટ્રસ્ટી વગેરેનો



MAS FINANCIAL SERVICES LIMITED

CIN: L65910GJ1995PLC026064 Regd. Office: 6, Narayan Chambers, Gr Floor, B/h Patang Hotel, Ashram Road, Ahmedabad-380009, Gujarat Tel: 079-41106500, Fax: 079-41106597/561, Website: www.mas.co.in E-mail: riddhi_bhayani@mas.co.in

NOTICE

Notice is hereby given that pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015("LODR"), Meeting of the Board of Directors of the Company will be held on Wednesday, February 5, 2020 inter- alia, to consider and approve Unaudited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and nine months ended on December 31, 2019; Re-appointment of Mrs. Daksha Niranjan Shah (DIN: 00376899) as Woman Independent Director of the Company for second term of 5 years; To consider and approve draft notice of Postal Ballot and such other business.

Further, in accordance with Regulation 46 of LODR, the details of the aforesaid meeting are available on the website of the Company i.e. www.mas.co.in and also on the website of the stock exchanges i.e www.nseindia.com and www.bseindia.com. For, MAS Financial Services Limited

A zota

ઝોટા હેલ્થ કેર લીમીટેડ

CIN: L24231GJ2000PLC038352

રજિસ્ટર્ડ ઓફિસઃ ઝોટા હાઉસ, ૨/૮૯૬, હીરા મોદી સ્ટ્રીટ, સગરામપુરા, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત.

ટેલીઃ +૯૧-૨૬૧-૨૩૩૧૬૦૧, ટેલી ફેક્સઃ ૦૨૬૧-૨૩૪૬૪૧૫

ઈ-મેલ આઈડીઃ info@zotahealthcare.com

વેબસાઇટઃ www.zotahealthcare.com

બોર્ડ મીટિંગની સુચના

અહીં સૂચના આપવામાં આવે છે કે સેબી (લિસ્ટિંગ ઓબલિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર

રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૨૯ સાથે નિયમન ૪૭ ને અનુસરીને,

બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક શુક્રવારે, ૦૭મી ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે

કંપનીની નોંધણી કચેરી સ્થિત ઝોટા હાઉસ, ૨/૮૯૬, હિરા મોદી સ્ટ્રીટ, સગરામપુરા, સુરત

-૩૯૫૦૦૨(ગુજરાત) ખાતે, બીજી બાબતોની સાથોસાથ, ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ ના રોજ

પુરા થયેલા ત્રિમાસિક અને નવ મહિનાના અનઓડિટેડ એકલ અને એકત્રિત નાણાકીય

ઉક્ત માહિતી કંપનીની વેબસાઈટ www.zotahealthcare.com પર અને સ્ટોક

સહી/-

અશ્વિન વારિયા

પરિશામોને ધ્યાનમાં લેવા અને મંજૂરી આપવા માટે યોજાવાની છે.

એક્સચેંજની વેબસાઇટ www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

Date:29.01.2020 Place: Ahmedabad

Riddhi Bhaveshbhai Bhayani Company Secretary and Compliance Officer
Membership No. A41206

સાથે પડ્યા વરસાદી છાંટા

નિષ્ફળ ગયો હતો. ખેડૂતોએ ખેતરમાં વાવેલો પાક વરસાદના પાણીમાં પલળી જવાથી તે પાક પશુઓને ખવડાવી શકાય તેવી હાલતમાં પણ રોજ વરસાદની આગાહી કરવામાં આવતા વરસાદી છાંટા જોવા મળ્યા રહ્યો નહોતો. પાક નિષ્ફળ જતા આવી હતી. ૨૮ જાન્યુઆરીના હતા. રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્ર, દીવ ખેડૂતોએ પાક વીમા કંપની પાસેથી રોજ વડોદરા, જામનગર, દિવ અને ગીર-સોમનાથના કેટલાક મદદની માગણી કરી હતી. હજુ સુધી સહિતનાં વિસ્તારોમાં વરસાદી વિસ્તારમાં વહેલી સવારથી આકાશમાં ખેડૂતોને નુકસાનીનું વળતર મળ્યું નથી ઝાપટાની આશંકા વ્યક્ત કરવામાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા ત્યાં આજે વહેલી સવારથી કેટલાંક આવી હતી. વહેલી સવારથી કેટલાંક હતા.

દ્વારા ૨૭ અને ૨૮ જાન્યુઆરીના વિસ્તારોના વાતાવરણમાં પલટો

દિશા રિસોર્સિસ લીમીટેડ

(અરિહન્ત એવેન્ય એન્ડ ક્રેડિટ લીમીટેડ નામ થી ઓળખાતી હતી) **૨જીસ્ટર્ડ ઓફીસઃ** ૩, રાજેશ એપાર્ટમેન્ટ, અજન્ટા કોમ. એસ્ટેટ પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૪.

ફોન: (ઓફિ.) ૨૭૫૪-૦૭૯૦, ૨૭૫૪૩૦૬૦ ઈ-મેઇલ: info@aacl.co.in CIN: L74110GJ1995PLC024869 વેબસાઇટ : www.aacl.co.in

નોટીસ

આથી અહી નોટીસ આપવામાં આવે છે કે સેબીના(લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડિસક્લોઝર રિકવાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ હેઠળ ૨૯ સાથે રેગ્યુલેશન ૪૭ ને અનુસરીને ૩૧મી િડસેમ્બર, ૨૦૧૯ના રોજ પૂરા થતા કંપનીના થર્ડ ક્વાર્ટર નઉ મહિનાના અંત સ્ટેન્ડલોન અનઓડીટેડ નાણાંકીય પરીણામને ધ્યાન ઉપર અને રિકાર્ડમાં લેવા કંપનીની રજીસ્ટર્ડ ઓફિસ શક્રવાર**. ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૨૦ના રોજ** કંપનીના બોર્ડ ઓફ્ર ડિરેક્ટરોની મીટીંગ મળનાર છે.

આ સંદર્ભમાં ટ્રેડીંગ વિન્ડો બુધવાર, ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી તમામ નિયુકત વ્યક્તિઓ માટે પહેલેથી જ બંધ રાખવામાં આવેલ છે. જે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના દિવસે થર્ડ ક્વાર્ટર અને નઉ મહિનાના અંતે સ્ટેન્ડલોન અનઓડીટેડ નાણાંકીય પરીણામના જાહેર કર્યા ના ૪૮ ક્લાક પછી

બ્રાન્ય ઓફિસ: આઈસીઆઈસીઆઈ બેંક લી. ઓફિસ નંબર ૨૦૧-બી, ૨જો માળ, રોડ નં.૧

તારીખ: ૩૧-૦૧- ૨૦૨૦

સિક્યુરાઇઝેશન રિકંસ્ટક્શન ફાઇનાન્સ એસેટ એન્ડ ઇનફોર્મ્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ. ૨૦૦૨ અને સિક્યુરિટી ઇન્ટરેસ્ટ ઈન્ફોર્સમેન્ટ ૨૦૦૨ની કલમ ૧૩ (૧૨) તેની સાથે અનુચ્છેદ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહીં નીચે સહી કરનાર આઈસીઆઈસીઆઈ બેંકના સત્તાવાર અધિકારીએ નીચે જણાવેલ લોકોને માંગણા નોટીસ આપી છે. આ નોટીસ આપ્યાથી ૬૦ દિવસની અંદર અહીં દર્શાવેલા નાણા ભરી જવા જણાવવામાં આવે છે.

કરજદારો નાણા ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. આથી કરજદારો અને સામાન્ય જનતાની જાણ માટે નીચે જણાવેલા અધિકારીએ અહી જેશાવેલી મિલ્કતનો સાંકેતિક કબ્જો લીધો છે જે કલમ ૧૩ (૪) અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ કાર્યવાહી કરી છે. કરજદારો અને સામાન્ય જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ પાસે આ મિલ્કત ટાંચમાં હોય કરજદારો અને સામાન્ય જનતાએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં.

ક્રમ નં.	કરજદારો/નું નામ / લોન એકાઉન્ટ નંબર	મિલ્કતની વિગત / સાંકેતિક કબ્જાની તારીખ	ડિમાંડ નોટીસની તારીખ / ડિમાંડ નોટીસની ૨કમ (રૂ)	શાખાનું નામ
Gran Same	અમિત પરમાર/ સલીમ પટેલ- LBBRH00004746726	પ્લોટ નં.ડી-૧૬, નારાયણ પાર્ક કો-ઓપ- હાઉસિંગ સોસાયટી લી., નવસારી એગ્રી, પાછળ, મકતમપુર રોડ, આર.એસ.નં. ૧૨૦, ભરૂચ- ૩૯૨૦૦૧, ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦	૩૧ જુલાઈ, ૨૦૧૯ રૂા. ૧૫,૮૨,૫૯૬.૦૦/-	ભરૂચ
૨.	સિંધ/ચાંદની શિવજીત સિંધ-	ફલેટ નં.૯૦૧, ૯મો. માળ, બિલ્ડિંગ નં.સી, શ્રીનાથજી ટાવર, ન્યાયમંદિર હોટેલ પાછળ, ઝડેશ્વર, આરએસ નં. ૧૮૨/૧, ભરૂચ- ૩૯૨૦૦૧, ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦.	૩૧ જુલાઈ, ૨૦૧૯ રૂા. ૯,૬૬,૮૫૩.∞/-	ભારૂચ
З.	સંદીપ એસ રાજપુત/ અર્ચના સંદીપ રાજપુત - LBBRH00002054059.	આરએસ નં.૧૮૨/૧, પ્લોટ નં.૨ પૈકી ની ૪૧૦૦-૦૦ સ્કેવર મી. લેન્ડ પુર્વ સાઇડ ૪૪૫.૩૫ સ્કેવર મી. ઓપન પ્લોટ કન્સટ્રક્શન ઇન ધ નેમ ઓફ શ્રી નાથજી ટાવર, બિલ્ડિંગ નં. એ, ફ્લેટ નં.૯૦૪ ભરૂચ-૩૯૨૦૦૧, ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦.	૭ નવેમ્બર, ૨૦૧૯ રૂા. ૧૯,૮૯,૮૩૩.૦૦	ભરૂચ

ડેમર કડાવ્યા કર્યકાર્યા આવેલા કાર્યા કરાય કરાય કર્યા માટે છે દિવસ તે મારે કાર્યા માટેલા કાર્યા કાર્યા કર્યા કર ૮ અને ૯ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (ઇન્ફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ની જોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાના ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે. ઓથોરાઈઝડ ઓફિસર આઈસીઆઈસીઆઈ બેંક લીમીટે

ઝોટા હેલ્થ કેર લિમિટેડ માટે તારીખઃ ૩૦.૦૧.૨૦૨૦ (કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર) સ્થળ : સુરત

સાંકેતિક કબ્જા નોટીસ

ાદાદા Bank પ્લોટ નં.બી૩, વાઇફાઈ આઈટી પાર્ક, વાગલે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, થાથે, મહારાષ્ટ્ર - ૪૦૦૬૦૪.

ક્રમ નં.	કરજદારો/નું નામ / લોન એકાઉન્ટ નંબર	મિલ્કતની વિગત / સાંકેતિક કબ્જાની તારીખ	ડિમાંડ નોટીસની તારીખ / ડિમાંડ નોટીસની રકમ (રૂ)	શાખાનું નામ
٩.	અમિત પરમાર/ સલીમ પટેલ- LBBRH00004746726	પ્લોટ નં.ડી-૧૬, નારાયણ પાર્ક કો-ઓપ- હાઉસિંગ સોસાયટી લી., નવસારી એગ્રી, પાછળ, મકતમપુર રોડ, આર.એસ.નં. ૧૨૦, ભરૂચ- ૩૯૨૦૦૧, ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦	૩૧ જુલાઈ, ૨૦૧૯ રૂા. ૧૫,૮૨,૫૯૬.૦૦/-	ભારુચ
₹.	સિંધ/ચાંદની શિવજીત સિંધ-	કલેટ નં.૯૦૧, ૯મો. માળ, બિલ્ડિંગ નં.સી, શ્રીનાથજી ટાવર, ન્યાયમંદિર હોટેલ પાછળ, ઝડેશ્વર, આરએસ નં. ૧૮૨/૧, ભરૂચ- ૩૯૨૦૦૧, ૨૫ જાન્યુઆરી, ૨૦૨૦.	૩૧ જુલાઈ, ૨૦૧૯ રૂા. ૯,૬૬,૮૫૩.∞/-	ભારૂચ
з.	સંદીપ એસ રાજપુત/ અર્ચના સંદીપ રાજપુત - LBBRH00002054059.	આરએસ નં.૧૮૨/૧, પ્લોટ નં.૨ પૈકી ની ૪૧૦૦-૦૦ સ્કેવર મી. લેન્ડ પુર્વ સાઇડ ૪૪૫.૩૫ સ્કેવર મી. ઓપન પ્લોટ કન્સટ્રક્શન ઇન ધ નેમ ઓફ શ્રી નાથજી ટાવર, બિલ્ડિંગ નં. એ, ફ્લેટ નં.૯૦૪ ભરૂચ-૩૯૨૦૦૧, ૨૫ જ્ઞન્યુઆરી, ૨૦૨૦.	૭ નવેમ્બર, ૨૦૧૯ રૂા. ૧૯,૮૯,૮૩૩.૦૦	ભરૂચ